Panasonic

Panasonic Energy India Co. Ltd.

G.I.D.C., Makarpura, P.B.No.: 719, Vadodara-390 010, Gujarat-India.

Phone: (0265) 2642661

ISO 9001: 2015 & ISO 14001: 2015 & ISO 45001:2018 Certified Company

November 11, 2024

To,
The Manager
Department of Corporate Services
The Bombay Stock Exchange Ltd
Phiroz Jeejeebhoy Towers, 14th Floor
Dalal Street, Fort
MUMBAI - 400 001

Scrip Code: 504093

Subject.: Regulation 30 read with Schedule III to the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations")

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 of Listing Regulations, please find enclosed copies of newspaper about publication of Unaudited Standalone Financial Results of the Company for the Quarter and six months ended on September 30, 2024 by the Board of the Directors of the Company at its meeting held on Friday, November 08, 2024.

The said financial results be published in the following newspapers on November 9, 2024:

- i) Business Standard (English) and
- ii) Loksatta (Vernacular)

This is for your information and record.

Thanking You.

Yours Truly,

For Panasonic Energy India Co. Ltd.

Sraban Kumar Karan Company Secretary

Encl.: As above

CIN: L31400GJ1972PLC002091

Web site: www.panasonicenergyindia.in, Email: sraban.karan@in.panasonic.com

Sunilkumar R. Jain (Advocate) under the instruction and direction of my client M Kanubhai Maljibhai Desai, hereby giving this public notice that the Residential House No. 41/A of the scheme known as "ShreejiKunj", situated on the land of Survey No. 2091 (Old Survey No. 1651) of mouje/village: Dehgam, Taluka: Dehgam and Dist. Gandhinagar, owned and possessed by Kanubhai Maljibhai Desai. One of the earlier Sale Deed bearing No. 1986 Dtd. 16/10/2014 executed between M/s. Shreeji Kunj Developers – A Partnership Firm and Prakashbhai Kalidas Prajapati along with its Registration Receipt, has been lost and not traceable. Said Original Sale Deed No. 1986 Dtd. 16/10/2014 along with its Registration Receipt, has not been mortgage to any Person/Bank/Government/Semi Government/Any financial institution. Out client sought my title clearance certificate by informing that said property is free from all sorts of encumbrances and title of said of property is lear and marketable. Hence Kanubhai Maljibhai Desai, hereby giving this public notice that the Residential Hous all sorts of encumbrances and title of said of property is clear and marketable. Hence we hereby with present public notice inform publically and to all concerned that if any individual, bank, government/semi government offices have any objection, right claim, interest, title, relation, encumbrance, maintenance with regards to said House No. 41/A then such objection should be raised with appropriate writter documents/evidence within 7 days from the date of publication of this notice. Please take a note that if no objections are received by us within 7 days from the date op publication of this notice, then title clearance certificate qua said property i.e. House


LE EXPART ASSOCIATES - Sunilkumar R. Jain, (Advocate) Place : Ahmedabad Date : 09.11.2024 Office No. B/133, Sumel-7, Nr. Soni Chawl, Odhav Ahmedabad Mo. No. 9825900946

Companies, **Insight Out**

Companies, Monday to Saturday

To book your copy, sms reachbs to **57575** or email order@bsmail.in





"KALINDI" 1, MAHAVIR JAIN SOCIETY, NR. S.T. DEPOT, GODHRA - 389001, Dist. Panchmahal, Gujarat. Phone: 9687678915 www.bankofbaroda.com

CORRIGENDUM

This is with reference to the e-auction notice published in this newspaper on Dt. 09.10.2024 for sale of properties through e-auction on 13.11.2024, for A/c : M/s. PATHAN FABRICATION, the e-auction is of the Property is postponed. Other details remain the same

Date: 08.11.2024, Place: Godhra

Authorised Officer, Bank of Baroda



STAR HOUSING FINANCE LIMITED

Dear Sir(s). (1) Kamlesh Soni S/o Shanti Lal Soni (Applicant) & (2) Dimple Soni W/o Kamlesh Soni (Co-Applicant), Add- G-104, Ambika Heights Opp. Devikropa Row House, Godadara, Surat City, Gujarat Pin - 395010. Availed Credit Facilities from Star Housing Finance Limited, SURAT, The Credit facilities are secured by mortgage of the following assets.

Description of Property EM Residential Land & Building measuring 535 Square Feet in the Name of Mr. Kamleshsoni S/o Shanti Lal Soni, Flat No 301, 3rd Floor A building, Swag Station Point, Gandadhara, Palsana, Surat, Gujarat Pir

You created mortgage of the above property. As you failed to adhere to the terms of the sanction Term Loan (s) ASHSUR - 98 loan the account is nov irregular and the debt has been classified as Non-performing asset or 30/07/2024 in accordance with the directives/guidelines relating to asset classification issued by the Reserve Bank of India consequent to the defaul committed by you in repayment of principal debt and interest thereor Therefore, the bank hereby calls upon you u/s 13(2) of the SARFAESI Act, 2002 by issuing this Demand Notice dated 14/10/2024 as the notice sent to above entioned address was returned undelivered. Your outstanding liabilities (i aggregate) due and owing to the bank is sum of Rs.7,61,386/- (Rupees Sever lakhs Sixty One Thousand Three Hundred Eighty Six Only) as on 14/10/2024 with further interest and incidental expenses, costs including principal, pena interest and over dues EMI. You are also liable to pay future interest at the contractual rate on the aforesaid amount together with incidental expenses cost, charges, etc within 60 days from the date of this notice falling which the undersigned may be constrained to initiate action under the said act to enforce the aforesaid securities.

Date: 14/10/2024

Sd/- Authorized Officer. STAR HOUSING FINANCE LIMITED

STAR HOUSING FINANCE LIMITED

Notice u/s 13(2) of Securitisation and Reconstruction o nancial Assets and Enforcement of Security Interest Act, 2002

Dear Sir(s), (1) Kamlesh Soni S/o Shanti Lal Soni (Applicant) & (2) Dimple Soni W/o Kamlesh Soni (Co-Applicant), Add- G-104, Ambika Heights Opp. Devikropa Row House, Godadara, Surat City, Gujarat Pin - 395010 Availed Credit Facilities from Star Housing Finance Limited, SURAT. The Credit facilities are secured by mortgage of the following assets.

Description of Property

EM. Residential Land & building measuring 503 Square Feet in the Name of Mr. Kamlesh Soni S/o Shanti Lal Soni, Flat No 307, 3rd Floor A building, Swag Station Point, Gandadhara, Palsana, Surat, Gujarat Pin 394310.

You created mortgage of the above property. As you failed to adhere to the terms of the sanction Term Loan (s) ASHSUR - 99 loan the account is nov irregular and the debt has been classified as Non-performing asset on 30/07/2024 in accordance with the directives/guidelines relating to asset classification issued by the Reserve Bank of India consequent to the defaul committed by you in repayment of principal debt and interest thereon. Therefore, the bank hereby calls upon you u/s 13(2) of the SARFAESI Act, 2002 by issuing this Demand Notice dated 14/10/2024 as the notice sent to above mentioned address was returned undelivered. Your outstanding liabilities (in aggregate) due and owing to the bank is sum of Rs.7,61,386/- (Rupees Seven lakhs Sixty One Thousand Three Hundred Eighty Six Only) as on 14/10/2024 with further interest and incidental expenses, costs including principal, penal interest and over dues EMI. You are also liable to pay future interest at the contractual rate on the aforesaid amount together with incidental expenses cost, charges, etc within 60 days from the date of this notice falling which the undersigned may be constrained to initiate action under the said act to enforc the aforesaid securities.

Date: 14/10/2024

Sd/- Authorized Officer. STAR HOUSING FINANCE LIMITED



STAR HOUSING FINANCE LIMITED

Dear Sir(s), (1) Jitendra Sanjay Chauhan (Applicant), (2) Neelam W/o Sanja Chauhan (Co- Applicant), Add -Room 8/183, Gujarat Housing Board, Darjan Cinema, Umarwada, City Surat, Gujarat, Pin- 395010. Availed Credit Facilities from Star Housing Finance Limited, SURAT. The Credit facilities are secured by mortgage of the following assets.

Description of Property EM. Residential Land & building measuring 753 Square Feet in the Name of Mr. Jitendra Sanjay Chauhan & Mrs. Nilam Sanjay Chauhan, Flat No C/202, 2nd Floor, Shree Laxmi Residency, Kadodara, Palsana Dist. Surat. Gujarat. boundaries : As per Sale Deed Document: East

-Adj Road, West - Adj. Road, North - Adj Constructed Property, South - Adj Open Land.

You created mortgage of the above property. As you failed to adhere to the terms of the sanction Term Loan (s) ASHSUR - 138 loan the account is now irregular and the debt has been classified as Non-performing asset on 30/07/2024 in accordance with the directives/guidelines relating to asse classification issued by the Reserve Bank of India consequent to the default committed by you in repayment of principal debt and interest thereon. Therefore, the bank hereby calls upon you u/s 13(2) of the SARFAESI Act, 2002 by issuing this Demand Notice dated 14/10/2024 as the notice sent to above mentioned address was returned undelivered. Your outstanding liabilities (in aggregate) due and owing to the bank is sum of Rs.9,49,032/- (Rupees Nine Forty Nine Thousand Thirty Two Only) as on 14/10/2024 with further interest and incidental expenses, costs including principal, penal interest and over dues EMI. You are also liable to pay future interest at the contractual rate on the aforesaid amount together with incidental expenses, cost, charges, etc within 60 days from the date of this notice falling which the undersigned may be constrained to initiate action under the said act to enforce the aforesal securities.

Date : 14/10/2024 Place : Surat

Sd/- Authorized Office STAR HOUSING FINANCE LIMITED

Cholamandalam Investment and Finance Company Limited Cholamandaram investment and rimance Company Limited Registered office at Chola Crest C-54 & 55,Super B-4, Thiru vi ka industrial Estate, Guindy, Chennal-800032 **Branch Office**: B-203, 2nd Floor, The First, Besides ITC Narmada, Blh Keshav Baug, Vastrapur, Ahmedabad – 380015

POSSESSION NOTICE [Immovable Property [Rule 8(1)] Whereas the undersigned being the Authorised Officer of M/s Cholamandalam Investment and Finance Company Limited, having its registered office at "Chola Crest", C 54 & 55, Super B-4, Thiru-vi-ka Industrial Estate, Guindy, Chennai 600032 and Branch office at B-203, 2nd Floor, The First, Besides ITC Narmada, B/h Keshav Baug, Vastrapur, Ahmedabad – 380015 under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13[12] read with Rule 3 of the Security Interest [Enforcement] Rules, 2002 issued a demand notice dated 29/07/2024 to 1. KISHINCHAND CHELARAM DHARWANI, 2. NITESH KISHANCHAND DHARWANI, & MAYA KISHINCHAND DHARWANI, Benglangfare, afforced to accept processor and Conference and Conference

DHARWANI, hereinafter referred to as borrower and Co-Borrowers in Loan A/c No. XOHEAHM00000517079 to repay the amount mentioned in the notice being Rs.23,22,908.399 (Rupees: Twenty Three Lakhs Twenty Two Thousand Nine Hundred Eight and Thirty Nine Paisa Only] as on 26-07-2024 with interest thereon within 60 days from the date of receipt of The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers in particula and the Public in general that the undersigned has taken POSSESSION of the property describes herein below in exercise of the powers conferred on him under Section 13[4] of the said Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this **08th day of November, 2024**.

The Borrowers' attention is invited to provisions of Sub-section (8) of Section 13 of the Act, in respe of time available, to redeem the secured assets. The borrowers in particular and the Public in general are hereby cautioned not to deal with the property and any dealings with the said property will be subject to the charge of Mys Cholamandalar Investment and Finance Company Limited, for an amount of being Rs. 23,22,988.39! - [Rupess Twenty Three Lakhs Twenty Two Thousand Nine Hundred Eight and Thirty Nine Paisa Only] as

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY PROPERTY: 1. Property Land Bearing Plot No. C/7 Forming Part Of City Survey No. 2619 Paikit Admeasuring 140 Sq. Mtrs., And Construction Thereon Situated At City Survey Ward Sardamagar, Taluka City in The District Of Ahmedabad And Registration Sub District Of Ahmedabad -6 [Naroda]. Bounded As Under East: Passage, West: Road, North: Plot No. C/7 Paiki, South: Passage PROPERTY: 2- Room No. 7 Forming Part Of City Survey No. 8744 Admeasuring 36.1 At Sq. Mtrs., & City Survey No. 8745 Admeasuring 36.1 4 Sq. Mtrs., And Construction Thereon Situated At City Survey Ward Sardamagar, Taluka City In The District Of Ahmedabad And Registration Sub District Of Ahmedabad -6 [Naroda]. Boundary of city survey no.8744; East: Passage, West: Cls No. 2619, North: Property of C/7, South: Cls No.8745, And Boundary of city survey no.8745; East: Gali Way. West: Passage, North: Cls No. 8744, South: Cls No.2619.

Date: 08-11-2024 Cholamandalam Investment & Finance Co. Ltd

PUBLIC NOTICE

otice is hereby given to the public at larg hat our clients are negotiating to purchas and M/s Dharmadev Infrastructure Ltd. ompany duly incorporated and register under the provisions of Company Act, 1956 [asamended] having CIN U45200GJ2005PLCO46616 and having egistered address at Dharmdev House Shyamal Cross Road, Satellite, Ahmedabad 380015 through authorized signatory M Swapnil Kadam are intending to sell, transfe assigned and convey all their/its right, title and interest together with all the benefit attached thereto in the property described in he Schedule hereto below free from a

All persons having any direct or indirect claim, objection, demand, share, right, title nterest and/or benefit in respect of or agains the said flat or any part thereof including b way of sale, transfer, assignmen conveyance, exchange, right, title, interes share benefit, lease, sub-lease, tenancy sub-tenancy, license, lien, mortgage, charg encumbrance, possession, right of us occupation and possession, famil arrangement/ settlement/ partition agreement, understanding, declaration ndemnity, lis-pendens, Developmer agreement, joint Development agreemen oint venture agreement, decree or order o nterim order of any court of law an ompetent authority, partnership, allotme or otherwise howsoever and of whatsoever nature are hereby requested to give notic hereof in writing/lodge claim in writing with a documentary evidence to the undersigned naving its office address at 8A & 8B, 2n Floor, Building No.24 BD, Rajabahadu Compound, Ambalal Doshi Marg, For Mumbai-400001 having Email advashokpurohit@gmail.com within 14 day from the date hereof failing which th laim/claims if any, of such person or person or any other entity recognized under the provisions of law will be considered to have peen waived, released, relinquished and o

THE SCHEDULE ABOVE REFERRED TO All that piece and parcel of land being and situate at Village Malad, Taluka Boriva pearing Survey No.343, Hissa No.2 and corresponding CTS No.605, 605/1 to 10 admeasuring about 413.75 sq. mtrs o hereabouts together with Building "Dayabha Mansion" standing thereon and all the penefits attached thereto situated at Static Road, Malad (West), Mumbai-400 064 Dated this 9th day of November 2024

Ashok Purohit & Co

Pharmaceuticals & Medical Devices Bureau of India (PMBI)
(Set up under the Department of Pharmaceuticals, Govt. of India)

B-500, Tower – B, 5th Floor, World Trade Center, Nauroji Nagar, New Delhi – 110029
Telephone: 011-49431800/49431811/49431854/49431829/49431894/49431874
Website: www.janaushadhi.gov.in

e-TENDER FOR SUPPLY OF DRUGS ON RATE CONTRACT BASIS **FOR TWO YEARS**

e-Tender for supply of 336 nos. of DRUGS for "Pradhan Mantri Bhartiya Janaushadhi Pariyojana (PMBJP)" are invited by PMBI. Last date and time for submission of online bids against e-Tender no. PMBI/DRUG/RC-218/2024 dated 05/11/2024 for supply of drugs is 29/11/2024 up to 17:00 hours.

For detailed eligibility criteria, terms & conditions of the tender, please visit the websites https://eprocure.gov.in/eprocure/app & https://janaushadhi.gov.in.

CEO, PMBI



STAR HOUSING FINANCE LIMITED

Financial Assets and Enforcement of Security Interest Act, 2002 Dear Sir(s), (1) Satendra Chaudhary S/o Girish Chaudhary (Applicant) & (2) Meer W/o Satendra Kumar Chaudhary (Co- Applicant), Add: 144 Dhiraj Nagar-1 Godadara Aaspas Mandir, Surat, Pin – 394230. Availed Credit Facilities from Star Housing Finance Limited, SURAT. The Credit facilities are secured by mortgage of lowing assets.

Description of Property

EM Residential Land& building measuring 494 Square Feet in the Name of Mr. Satyendrakumar Girishmuni Chaudhary, Flat No 408, 4th Floor Vinayak Residency of Shree Nivas, Green City Part 2, Survey No 133/3. Block No 108, Moje Kadodara, Palsana, Dist Surat, Gujarat. Boundaries: As per Sale Deed Document: East-Society Road, West- Society

Common Plot, North- Society Boundary, South- Plot No 6. You created mortgage of the above property. As you failed to adhere to the terms of the sanction Term Loan (s) ASHSUR - 178 loan the account is now irregular and the debt has been classified as Non-performing asset or 30/07/2024 in accordance with the directives/guidelines relating to asset classification issued by the Reserve Bank of India consequent to the defaul committed by you in repayment of principal debt and interest thereon Therefore, the bank hereby calls upon you u/s 13(2) of the SARFAESI Act, 2002 by issuing this Demand Notice dated 14/10/2024 as the notice sent to above mentioned address was returned undelivered. Your outstanding liabilities (ir aggregate) due and owing to the bank is sum of Rs.7,37,711/- (Rupees Sever Lakhs Thirty Seven Thousand Seven Hundred Eleven Only) as on 14/10/2024 with further interest and incidental expenses, costs including principal, pena interest and over dues EMI. You are also liable to pay future interest at the contractual rate on the aforesaid amount together with incidental expenses cost, charges, etc within 60 days from the date of this notice falling which the undersigned may be constrained to initiate action under the said act to enforce the aforesaid securities.

Date: 14/10/2024 Place : Surat

Sd/- Authorized Officer STAR HOUSING FINANCE LIMITED

AICICI Bank Branch Office: ICICI Bank Limited, Solitaire Building, Opposite Church, Indira Gandhi Marg, Jamnagar- 361008. PUBLIC NOTICE-TENDER CUM E-AUCTION FOR SALE OF SECURED ASSET

[See proviso to Rule 8(6)]

Notice for sale of immovable asset(s)

Notice for sale of immovable asset(s)

E-Auction Sale Notice for the sale of immovable asset(s) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002. This notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/ charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of ICICI Bank Limited will be sold on 'As is where is', 'As is what is' and 'Whatever there is' as per the brief particulars given hereunder;

Sr No	. Name of borrower(s)/ Co-Borrowers/ Guarantors/ Loan Account No.	Details of the Secured asset(s) with known encumbrances, if any	Amount Outstanding	Reserve Price Earnest Money Deposit	Date and Time of Property Inspection	Date & Time of E-Auction
(A	(B)	(C)	(D)	(E)	(F)	(G)
1.	Pravin Kumar (Borrower)/ Manisha Devi (Co-Borrower) Loan A/c No. LBJAM00005138471/ LBJAM00005138473	Sub Plot No. 141/3, Madhuram Residency, Near Shubham Dairy, Revenue Survey No. 5/1, 5/2, 10, 11/1, 11/2, 12, Rajkot Road, Navagam Ghed, Jamnagar, Gujarat- 361001. Admeasuring an area of 44 Sq. MtrFree Hold Property	Rs. 12,93,624/- (as on November 06, 2024)	Rs. 13,50,000/- Rs. 1,35,000/-	November 26, 2024 From 11:00 AM To 12:00 Noon	December 17, 2024 From 11:00 AM Onward
2.	Asha Nareshbhai Nanda (Borrower)/ Nareshkumar Devenmal Nanda (Co-Borrower) Loan A/c No. LBJAM00002761865.	Sub Plot No. 231D, Jadeshwar Park, Behind Ranjit Sagar Road, Behind Patel Park, Revenue Survey No. 1101, Jamnagar 361004. Admeasuringan area 53 Sq. MtrFree Hold Property	Rs. 13,23,328/- (as on November 06, 2024)	Rs. 19,30,000/- Rs. 1,93,000/-	November 26, 2024 From 12:00 Noon To 01:00 PM	December 17, 2024 From 11:15 AM Onward

The online auction will be conducted on the website (URL Link- https://disposalhub.com). of our auction agency M/s NexXen Solutions Private Limited. The Mortgagors/ Noticees are given a last chance to pay the total dues with further interest by December 16, 2024 before 04:00 PM else the secured asset(s) will be sold as per schedule.

The prospective bidder(s) must submit the Earnest Money Deposit (EMD) Demand Draft (DD) (Refer Column E) at ICICI Bank Limited, Solitaire Building, Opposite Church, Indira Gandhi Marg, Jamnagar- 361008. on or before December 16, 2024 before 03:00 PM Thereafter, they have to submit their offer through the website mentioned above on or before December 16, 2024 before 04:00 PM along with the scanned image of the Bank acknowledged DD towards proof of payment of EMD. In case the prospective bidder(s) is/ are unable to submit his/ her/ their offer through the website, then the signed copy of tender documents may be submitted at ICICI Bank Limited, Solitaire Building, Opposite Church, Indira Gandhi Marg, Jamnagar- 361008. on or before December 16, 2024 before 05:00 PM. Earnest Money Deposit DD/PO should be from a Nationalised/ Scheduled Bank in favour of ICICI Bank Limited' payable at Jamnagar.

For any further clarifications in terms of inspection, Terms and Conditions of the E-Auction or submission of tenders, contact ICICI Bank Employee Phone No. 8356846884/7573024297.

Please note that the Marketing agencies 1. M/s NexXen Solutions Private Limited 2. Augeo Asset Management Private Limited have also been engaged for facilitating the sale of this property.

The Authorised Officer reserves the right to reject any or all the bids without furnishing any further reasons.

For detailed Terms and Conditions of the sale, please visit www.icicibank.com/n4p4s Date : November 08, 2024

Authorized Officer ICICI Bank Limited Place : Jamnagar

Panasonic Panasonic Energy India Co. Ltd.

CIN: L31400GJ1972PLC002091

Regd. Office: G.I.D.C. Makarpura, P.B. No. 719, Vadodara-390010, Gujarat, India. Phone: (0265) 2642661 Email: company.secretary@in.panasonic.com

Web site: www.panasonicenergyindia.in Extract of Unaudited Financial Results for the quarter and six months ended September 30, 2024

(₹ In Lacs								
		Quarter Ended			Six Months Ended		Year to date ended	
Sr. No.	Particulars	September 30, 2024 (Unaudited)	June 30, 2024 (Unaudited)	September 30, 2023 (Unaudited)	September 30, 2024 (Unaudited)	September 30, 2023 (Unaudited)	March 31, 2024 (Audited)	
01	Total income from operations (net)	6,949.94	6,418.58	6,910.16	13,368.52	14,658.41	29,548.26	
02	Net Profit / (Loss) from ordinary activities before tax	537.35	563.54	462.90	1,100.89	808.90	1,547.49	
03	Net Profit / (Loss) from ordinary activities after tax	404.13	414.06	346.17	818.19	605.20	1,164.35	
04	Total Comprehensive Income for the period (comprising profit and other comprehensive income for the period net of tax)	388.10	398.02	330.56	786.12	573.97	1,100.22	
05	Paid up Equity Share Capital (Face Value of ₹10 each)	750.00	750.00	750.00	750.00	750.00	750.00	
06	Earnings per share (Face Value of INR 10 each) Basic and Diluted	5.39	5.52	4.62	10.91	8.07	15.52	

NOTE:

Place: Pithampur

Date: 8th November, 2024

- 1) The above unaudited financial results have been reviewed by the Audit Committee and aproved by the Board of Directors of the Company in their respective meetings held on November 08, 2024. The Statutory Auditors of the Company have performed Limited review and have issued unmodified
- 2) The above unaudited financial results of the Company have been prepared in accordance with the Indian Accounting Standards (IND AS) prescribed under section 133 of the Companies Act, 2013 (the "Act") read with relevant rules issued thereunder, other accounting principles generally accepted in India and guidelines issued by the Securities and Exchange Board of India.
- 3) As per Indian Accounting Standard (Ind AS) 108 'Segment Reporting', the business of the Company mainly comprises sale of "Batteries" which has beer identified as a single reportable segment.
- 4) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with Stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website namely www.bseindia.com and on the Company's website www.panasonicenergyindia.in.

For Panasonic Energy India Co. Ltd. Akinori Isomura Chairman & Managing Director

The Only battery Company in India Manufacturing 100% Eco-friendly Batteries

ગટરનું ગંદુ અને દુર્ગંધભર્યું પાણી ઉભરાવાની સમસ્યાથી પરેશાન સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે આક્રોશ ફાટી નીકળ્યો ઓક્ટોબરમાં કોલસાનું ઉત્પાદન ૭.૪% અમિદિ લીર્ડનં. ૧માં ઉભરાતી ગટરોથી રહીશીનો હલ્લાનો હલ્લાનો હલ્લા મુંબઈ,તા.૮ મુંબઈ,તા.૮ કોલસા મંત્રાલયના જાગાત્યા હતી. કોલસા મંત્રાલયના જાગાત્યા હતા. કોલસા કોલસા મંત્રાલયના જાગાત્યા હતા. કોલસા મંત્રાલયના જાગાત્યા હતા. કોલસા મંત્રાલયના જાગાત્યા હતા. કોલસા મંત્રાલયના જાગાત્યા હતા. કોલસા કોલસા કોલસા કોલસા કોલસા કોલસા હતા. કોલસા કોલસા કોલસા કોલસા હતા. કોલસા કોલ કોલસા કોલ

ભાજપની વિકાસની નીતિને પાલિકાનું વહીવટી તંત્ર નેવે મૂકીને ચાલી રહ્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે



પાલિકાનું વહિવટી તંત્ર ધારાસભ્ય અને જિલ્લા કલેકટરની મૌખિક સુચનાને ઘોળીને પી ગયું! આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર એક માં છેલ્લા બે મહિનાથી દુર્ગંધ યુક્ત ગટરો ઉભરાઈ રહી છે. જેની લેખિત, મૌખિક તેમજ ટેલિફોન દ્વારા પાલીકા સત્તાધીશોને અનેકો વાર રજૂઆત કરવમાં આવી હતી. છતાંય પાલિકા તંત્ર પ્રાથમિક સુવિધાના કામો કરવામાં તદ્દન નિષ્ફળ રહી સ્થાનિક રહીંશોને હેરાન પરેશાન કરી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિકોએ ગટરની સમસ્યા મુદ્દે ધારાસભ્ય ડી.કે.સ્વામીને પણ રજુઆત કરી હતી. જે બાદ ધારાસભ્યએ પાલિકાને સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી છતાંય પાલિકાએ કામગીરી કરવાની તસ્દી લીધી ન હતી. એટલું જ નહીં સ્થાનિક દ્વારા આ મુદ્દે જીલ્લા કલેકટર તુષાર સુમેરાને પણ સમસ્યા મુદ્દે ટેલિફોનિક ફરિયાદ કરતા કલેકટરે આશ્વાસન આપ્યું હતું. કે મેં સૂચના આપી છે, કૉમગીરી થઈ જશે પરંતુ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. આ બાબતે પાર્લિકાના સત્તાધીશો જાણે ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને ધારાસભ્ય ડી.કે.

તરફ પ્રાથમિક સુવિધાઓ પૂરી

નગરની ભોળી જનતા બની

ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

હોય તેવું રહી છે. ઉભરાતી દુર્ગંધયુક્ત

પ્રતીત ગટરોના ત્રાસથી સ્થાનિકો

वाधोडीया रोड ब्रांच के नवीनीकरण, फर्नीचर

विद्युतीकरण, डेटा केबलिंग और वातानुकूल

ऑनलाइन निविदा आमंत्रित है.

पाइपिंग कार्यों के लिए टू बिड सिस्टम मे

अधिक जानकारी के लिए हमारी वेबसाईट

www.centralbankofindia.co.in और

/EPROC देखें

सेंट्रल बैंक ऑफ इंडिया क्षेत्रीय कार्यालय बडौद

कालोल ब्रांच के नवीनीकरण, फर्नीचर,

विद्युतीकरण, डेटा केबलिंग और वातानुकूल

पाइपिंग कार्यों के लिए टू बिड सिस्टम

अधिक जानकारी के लिए हमारी वेबसाईट

www.centralbankofindia.co.in और

https://centralbank.abcprocure.com

/EPROC देखें

ऑनलाइन निविदा आमंत्रित है.

रने की अंतिम तारीख. 29.11.2024.

क्षेत्रीय प्रमुख बडौदा

સ્વામીની ટેલીફોનીક સુચનાને પણ જાણે ઘોળીને પી ગયા હોઈ તેમ લાગી રહ્યું છે.

નગરી વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા અને તેનાથી રહ્યું છે. એક તરફ આમોદ વિસ્તારમાં રોગચાળો ફેલાવાની દહેશતથી સ્થાનિકોમાં પાલીકા દ્વારા કરોડો રૂપિયાના ભારે રોષ ફેલાયો છે. નગરપાલિકાનાં ઉપપ્રમુખનો વિસ્તાર વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત હોવા છતાં ગટરની સમસ્યાનું સમાધાન લાવવામાં પાલિકા કરવામાં આવે છે તો બીજી

ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે કરોડો પાડવામાં પાલિકા સત્તાધીશોનો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ આમોદની ભાજપ વહીવટ ખાડે ગયો હોઈ તેમ શાસિત નગર પાલિકા સરકારનાં સ્વચ્છતા અભિયાનના લાગી રહ્યું છે. ભાજપ શાસિત મિશનને બટ્ટો લગાડતા હોય તેમ લાગી રહ્યુ છે. ભાજપની આમોદ[ે] નગર પાલિકાના

છેલ્લા બે મહિના ઉપરાંતના સમયથી પુરસારોડ નવી વિકાસની નીતિને પાલિકાનું વહીવટી તંત્ર નેવે મૂકીને ચાલી આંતરિક વિખવાદનો ભોગ

અને દુર્ગંધ યુક્ત ગટરના પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા

ભરૂચ,તા.૮

આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં ગટરનું ગંદુ અને દુર્ગંધભર્યું પાણી ઉભરાવાની સમસ્યાથી પરેશાન સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે આક્રોશ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક મહિલાઓએ રણચંડી બની નગરપાલિકા બેદરકાર હોય તેમ લાગી રહ્યું છે. હાય-હાયના નારા લગાવી રોષ વ્યક્ત કર્યો હતોઆમોદ નગરપાલિકાનાં વોર્ડ નંબર એકમાં રહેતા સ્થાનિકો દૂષિત

> હું પઠાણ મોહસીનખાન અબ્દુલલતીફ ગીતાદેવી મગનલાલ અગ્રવાલ મારા પુત્રનું નામ પઠાણ

મૂજીબખાન મોહસીનખાન હતુ બદલીને હત બંદલીને પઠાણ મુજબખાન ગીતાદેવી મગનભાઇ શાહ કરેલ છે. એસ. એફ.૨૦૨, રાખેલ છે. દાર અલ અશરફ ફલવાડી એફ-૧૪, સામ્રાજય સોસાયટી-૧ ક્રોસ રોડ, કાન્હા પ્લેટિનિયમ, અકોટા, વડોદરા. ટી.પી-૧૩, વડોદરા.

फ्रेनरा बैंक Canara Bank 🕸

Changed My Name

From Trivedi Bhaskarbhai Kaushikbhai

To Trivedi Bhaveshkumar Kaushikbhai

and Changed My Wrong Birth date

24/10/1987 To Correct Date of Birth

27/02/1984. Address: Kismatnagar

Society, Behind Railway A Cabin,

Bajwa, Vadodara. 391310

કેનેરા બેંક - વડોદરા રાવપુરા મેઈન શાખા મુ.પો. નં. ૧૮७, ગ્રાઉન્ડ ફલોર, લોંઠાણા બિલ્ડીંગ, પ્રો. માણેક રાવ રોક, રાવપુરા, વકોદરા.

भा३ नाभ

કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

આથી નીચે સહી કરનાર **કેનેરા બેંક** ના અધિકૃત અધિકારી તરીકે, ઘી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ[°]એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ નો નિયમ ૫૪) (અહીં પછી 'અધિનિયમ' તરીકે ઓળખવામાં આવે છે) અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ ના નિયમ–૩ સાથે વાંચતા કલમ ૧૩(૧૨) અન્વયે પ્રાપ્ત અધિકારોની રૂઇએ કરજદાર/જામીનદાર/માલિક શ્રી સુહાસ દિગંબર પિકલે, એફ-૫૦૨ માઈલસ્ટોન એપાર્ટમેન્ટ, વાસણા ભાષલી રોક, વકોદરા-૩૯૧૪૧૦ અને શ્રીમતી મંજુષા સુદ્વાસ પિકલે, એફ-૫૦૨, માઈલસ્ટોન એપાર્ટમેન્ટ, વાસણા ભાષલી રોડ, વડોદરા-૩૯૧૪૧૦ અને શ્રી માધવ સીતારામ નેલેંકર બી-૧૮૬ સુકૃતિ નગર સોસાથટી, દિવાળીપુરા રોક, વકોદરા-૩૯૦૦૧૫ ને તારીખઃ ૩૦.૦૮.૨૦૨૪ ના રોજ ડીમાન્ડ નોટીસ પાઠવીને નોટીસમાં દર્શાવેલ લેણી રકમ **રૂા. ૧૩,૦૨,૭૯૬.७७ (એક રૂપિયા તેર લાખ બે હજાર સાતસો છન્નુ અને પૈસા સીત્યોતેર** પુરા) સાથે વધુ વ્યાજ અને આકસ્મીક ખર્ચ અને રકમ નોટિસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ભરપાઇ કરવા જણાવામાં આવેલ છે. કરજદાર રકમ ચુકવવામાં નિષ્ફળ ગયા હોઈ, આથી મિલકતના કરજદાર અને જાહેર જનતાને નોટિસ આપવામાં આવે છે કે નીચે સહી કરનારે સિક્ચોરિટી ઈન્ટરેસ્ટ ના નિયમ ૮ અને ૯ સાથે વાંચતા ઉક્ત એક્ટના સેક્શન ૧૩(૪) હેઠળ તેને/તેણીને પ્રાપ્ત થયેલ અધિકારનો ઉપયોગ કરીને નીચે જણાવેલી મિલકત **સાંકેતિક કબજો તા. ૦૬.૧૧.૨૦૨૪** ના રોજ લીધો છે.

કરજદાર અને જાહેર જનતાને સદર મિલ્કત સંદર્ભે કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરવા ચેતવણી આપવામાં આવે છે તેમજ જો કોઈ પણ વ્યવહાર કરશો તો સદર વ્યવહાર કેનેરા બેંકની બાકી લેણી રકમ રૂા. ૧૩,૦૨,૭૯૬.૭૭ (એક રૂપિયા તેર લાખ બે હજાર સાતસો છન્નુ અને પૈસા સીત્થોતેર પરા) અને તેના પરનું વ્યાજ.

દેવાદારને ધ્યાન દોરવામાં આવે છે કે પોતાની મિલકત સેક્શન ૧૩ ના એક્ટ હેઠળ સબ સેક્શન (૮) મુજબ મિલકત મેળવવા રકમ ભરવા સમયની જોગવાઇ કરવામાં આવી છે.

સ્થાવર મિલ્કત નું વર્ણન

તમામ ભાગ અને ફિસ્સો બિન ખેતીલાયક પ્લોટ ની જમીન નો આર.એસ. નં. ૩૫૩, બ્લોક નં. ૩૦૧, એફ.પી. નં. ૩ (જુનો નં. ૩૬), ઓ.પી. નં. ૩૬, ટી.પી. નં. ૩, મોજે ભાચલી, વોર્ડ ૧૧ જે ફલેટ નં. બી–७૦૨ તરીકે ઓળખાતુ, ટાવર–બી, હમો માળ, દેલી ગ્રીનસ, માઇલસ્ટોન રેસીડન્સી ની સામે, કેદાર બુમિયા માર્ગ ની બાજુ, વાસણા ભાચલી રોડ, વડોદરા–૩૯૧૪૧૦–બિલ્ટઅપ એરીયા – ૮૮.૨૯ યોરસ મીટર, અવિભાજીત કોમન જમીન નો हિસ્સો – ૩૯.૪૮ ચોરસ મીટર, અવિભાજીત પ્લોટ નો કોમન હિસ્સો – ૪.૫૨ ચોરસ મીટર, મિલકતની માલિકી–શ્રી સુહાસ દિગંબર પિકલે. ચર્તુસીમાઃ ઉત્તરઃ ફલેટ નં. બી-७०૧, દક્ષિણઃ કોમન પ્લોટ ને સ્પેસ, પૂર્વઃ પાર્કિંગ સ્પેસ, પશ્ચિમઃ ઓટીએસ અને કલેટ નં. બી ७०૩.

તા.: ૦૯.૧૧.૨૦૨૪ સ્થળઃ વડોદરા, રાવપુરા

નાંદોદ નર્મદા, રાજપીપળા

ગુજરાત– **૩૯૩૧૪૫** (સ્વ.

માવનાબેન અરવિંદભાઈ

પટેલના કાનૂની વારસદાર)

જામીનદારઃ

સુધીર મનુ પટેલ

૧૧૨ જી વારખેડ

તા. નાંદોદ, નર્મદા,

ગુજરાત ૩૯૩૧૪૫

માટે પર્વગ્રહ વિના છે.

નોંધઃ વિવાદની સ્થિતિમાં આ નોટીસનો અંગ્રેજી અનુવાદ માન્ય ગણાશે.

केनरा बैंक Canara Bank 🕸 ि सिडिकेटवेंक Syndicate

કેનેરા બેંક -અલકાપરી શાખા એક્સપ્રેસ હોટલ ની સામે, આર.સી.દત્ત રોડ, અલકાપુરી, વડોદરા-૩૯૦૦૦૫. ફોનઃ ૦૨૬૫-૨૩૩૮૧૧૫

डेभाज्ड नोटीस

વિષયઃ સીક્યુરીટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સીયલ એસ્ટેટ એન્ડ એન્ફોસમેન્ટ ઓફ સીક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ની કલમ ૧૩(૨) હેઠળ ડિમાન્ડ નોટીસ

કરજદારોએ અમારી બેંક પાસેથી સમચાંતરે નીચેની લોન/કેડિટ સુવિધાઓનો લાભ લીધો છેઃ શાખા અને કરજદાર નું ร์ไหเฮร કુલ બાકી ગીરવે મુકેલ મિલકતનું વર્ણન લ્હણાના રકમ ગોધરા કસબા આર.એસ. નં. ૧૧૬૦ પૈકી ૧૬ SOD Synd MSE ગોધરા શાખા પ્રિન્સીપાલ માતા નં. ૯૮૦૧ એન.એ. જમીન પૈકી પ્રાઇવેટ SESEIS ३।. ૯,८८,३૯૬.५१ પ્લોટ નં. ૧૧, ક્ષેત્રફળ ૮૮ ચોરસ મીટર ,60,000.0 મેસર્સ રાજત ક્રિએશન એનપીએ વ્યાજ અને બાંધકામ મ્યુનીશીપલ ઘર નં. ૧/૨૫૫*/* મંજુર થયેલ eosoeu એચએન/૧૦ ઘર પૈકી ઉત્તર બાજુ જમીન અન્ય યાર્જીસ તારીખ બેંક ઓફ બરોડા સ્ટેશન ક્ષેત્રફળ ૪૪ ચોરસ મીટર જમીન અને બાંધકામ 31. 11.800.00 २७.०૯.२०२१ 15.05.2020 રોડ ગોધરા પાછળ . ગ્રાઉન્ડ ફલોર રહેણાંક ઘર ઝુલેલા સોસાયટી, એફ.સી.આઇ. ગોડાઉન ની સામે, ગોધરા કુલ બાકી વ્યાજનો દર ચિદ્રિયાવાડ, ગુજરાત-**३**।.e,ee,७e७.o1 13.40% કસબા તાલુકો ગોધરા, જીલ્લો–પંચમહાલ 326001 ગુજરાત–૩૮૯૦૦૧ ખાતે આવેલ છે OSL-SYND ટહેલ્યાણી સુનિલભાઈ ર્તુસીમાઃ ઉત્તરઃ આર. એસ. નં. ૧૧૬૯ પૈકી MORTGAGE ૫૫, શ્રી સવામી શાંતિ 31. 0.82.268.58 ૪મીન, દક્ષિણઃ ૬ મીટર રોઠ, પૂર્વઃ પ્રાઇવેટ પ્રકાશ સોસાયટી, દાહોદ વ્યાજ અને પ્લોટ નં. ૧૨, પશ્ચિમઃ પ્લોટ નં. ૧૧ માં ઘર. ,40,000.00 રોક, વાવડી બુઝર્ગ, પંચ અન્ય યાર્જીસ ગોધરા કસબા આર.એસ. નં. ૧૧૬૦ પૈકી ૧૬ મંજુર થથેલ મહેલ, ગોધરા, ગુજરાત-31. 39.930.44 તારીખ ખાતા નં. ૯૮૦૧ એન.એ. જમીન પૈકી પ્રાઇવેટ 32G009. 09.01.2019 કુલ બાકી પ્લોટ નં. ૧૧, ક્ષેત્રફળ ૮૮ ચોરસ મીટર જામીનદારઃ વ્યાજનો દર બાંધકામ મ્યુનીશીપલ ઘર નં. ૧/૨૫૫/ રૂા.७,८०,०૩૨.૧૯ 18.00% લધારામ ટહેલિચાણી એચએન/૧૦ ઘર પૈકી ઉત્તર બાજુ જમીન શ્રી રામ એજન્સી, ક્ષેત્રફળ ૪૪ ચોરસ મીટર જમીન અને બાંધકામ GECL 1.0 પ્રિન્સીપાલ ગ્રાઉન્ડ ફલોર રહેણાંક ઘર ઝુલેલા સોસાયટી, જુનું બસ સ્ટેન્ડ, ગોધરા (EXTENSION) રૂા. ૧,૯૫,૮૩૨.૦૦ એફ.સી.આઇ. ગોડાઉન ની સામે, ગોધરા ગુજરાત-3૮૯૦૦૧. કસબા તાલુકો ગોધરા, જીલ્લો–પંચમહાલ વ્યાજ અને ,34,000.0 ગુજરાત–૩૮૯૦૦૧ ખાતે આવેલ છે અન્ય યાર્જીસ મંજુર થચેલ ુ યર્તુસીમાઃ ઉત્તરઃ આર. એસ. નં. ૧૧૬૯ પૈકી તારીખ 31. 5,888.06 ૪મીન, દક્ષિણઃ ૬ મીટર રોક, પૂર્વઃ પ્લોટ નં 26.11.2021 કુલ બાકી ૧૧ પૈકી નું ઘર. પશ્ચિમઃ પ્લોટ ને.૧૧ પૈકી ઘર વ્યાજનો દર રૂા.૨,૦૨,૨૭૬.૭૯ ની કોમન વોલ. 11.24% રાજપીપળા શાખા તમામ ભાગ અને હિસ્સો રહેણાંક ઘર આવેલ તે HOUSING પ્રિન્સીપાલ 03.10.2021 ત્લોટ નં. બી–33, આદિત્ય બંગલો, સર્વે નં LOAN રૂા. ૧૫,૫૪,૪૮૦.૪ ૧૩૩૫/૧ સીટ નં. ૪૧, સીટી સર્વે નં બેલાબેન પટેલ અને વ્યાજ અને ૨૦/એ/૩૯, રાજપીપલા, તાલુકો નાંદોદ 0,00,000.00 H6-85&EIS અન્ય યાર્જીસ મંજુર થથેલ જીલ્લા–નર્મદા– ક્ષેત્રફળ એરીચા –૮૧.૮૪ સંદિપકુમાર એ પટેલ 3I. 35, UGY. 53 તારીખ યોરસ મીટર–૩૯૩૧૪૫. ચર્તુસીમાઃ ઉત્તરઃ પ્લોટ નંબર બી ૩૩ કુલ બાકી 31.03.2014 ત્લોટ નં. બી/30, દક્ષિણઃ ક મીટર રોક, પૂર્વ આદિત્ય બંગ્લોઝ, એમ. રૂા.૧૫,૯૧,૦૭૫.૦ પ્લોટ નં. બી/૩૨, પશ્ચિમઃ પ્લોટ નં. બી/૩૪. વ્યાજનો દર 10.64% વી. રોઠ, રાજપીપળા,

ઉપરોક્ત લોન/ક્રેડિટ સવલતો અહીં આપેલા શેડ્યૂલમાં વધુ વિશિષ્ટ રીતે વર્ણવેલ અસ્કચામતોના મોર્ટગેજર દ્વારા, તમારા દ્વારા અમારી તરફેણમાં અમલમાં મૂકાચેલા સંબંધિત દસ્તાવેજોના આધારે યોગ્ય રીતે સુરક્ષિત છે. તમે નિર્ધારિત નિયમો અને શરતો અનુસાર તમારી જવાબદારીઓનું નિકાલ કરવામાં નિષ્ફળ ગયા હોવાથી, બેંકે ઉપર મુજબ દેવું એનપીએ તરીકે વર્ગી કૃત કર્યું છે.

FARM

DEVELOPMENT

LOANS

8,00,000.00

મંજુર થયેલ

તારીખ

18.04.2013

વ્યાજનો દર

10.64%

પ્રિન્સીપાલ

રૂા. ૧,૦૧,७૨७.૬૫

અન્ય યાર્જાસ

રૂા. ૧,૯૫,૬૨૧.૪૪

કુલ બાકી

₹1.२,6७,3४6.06

આથી, અમે તમને વિષય અધિનિયમની કલમ ૧૩(૨) હેઠળ આ નોટિસ જારી કરીએ છીએ અને તમને ઉપરોક્ત <mark>૨૬મ</mark> ની સમગ્ર જવાબદારી ઉપાર્જિત અને અપ–ટુ–કેટ વ્યાજ અને અન્ય ખર્ચાઓ સાથે, તારીખથી સાઠ દિવસની અંદર કિસ્ચાર્જ કરવા માટે આહ્વાન કરીએ છીએ. નોટિસ, જેમાં નિષ્ફળ થવા પર અમે વિષય અધિનિયમની કલમ ૧૩(૪) હેઠળના તમામ અથવા કોઈપણ અધિકારોનો ઉપયોગ કરીશું. વધુમાં, તમે અમારી પૂર્વ સંમતિ વિના, કોઈપણ રીતે, શેડ્ચૂલમાં ઉદ્ઘેખિત કોઈપણ સુરક્ષિત સંપત્તિઓ સાથે વ્યવહાર કરવા માટે આથી પ્રતિબંધિત છો. આ વિષય અધિનિયમ અને /અથવા અમલમાં રહેલા અન્ય કોઈપણ કાયદા હેઠળ અમને ઉપલબ્ધ કોઈપણ અન્ય અધિકારો

સિકચોર્ડ મિલકત છોડાવવા ઉપલબ્ધ સમચ બાબતે ઉક્ત એક્ટના સેકશન ૧૩ ના સબ–સેકશન (૮)ની જોગવાઈ તરફ તમારૂ ધ્યાન દોરવામાં

બ્રાન્ચના રેકોર્ડમાં ઉપલબ્ધ તમારા છેલા જાણીતા સરનામાને કારણે રજિસ્ટર્ડ પોસ્ટ અભસ દ્વારા તમને ડિમાન્ડ નોટિસ પણ આપવામાં

તા.: ૦૯.૧૧.૨૦૨૪– સ્થળઃ વકોદરા

અને અન્ય એકમોમાંથી કોલસાનું ટકાનો વધારો દર્શાવે છે. એપ્રિલ-ઉત્પાદન ઓક્ટોબરમાં વધીને ૧૬.૫૯ એમટી થઈ ગયું હતું જે ગયા વર્ષના સમાન મહિનામાં ૧૧.૭૦ એમટી હતું. કોલસાની ગયા નાણાકીય વર્ષના ઑક્ટોબરમાં MT હતું.

કોલસા મંત્રાલયના જણાવ્યા મંત્રાલયે જણાવ્યું હતું કે કેપ્ટિવ અનુસાર, ઓક્ટોબરમાં કોલસાનું અને અન્ય એકમોમાંથી કોલસાની ઉત્પાદન ૭.૪ ટકા વધીને ૮૪.૪૫ ં ડિસ્પેચ પણ ઓક્ટોબર ૨૦૨૪માં મિલિયન ટન (MT) થયું છે, જે વધીને ૧૬.૧૮ એમટી થઈ ગયા વર્ષના સમાન મહિનામાં હતી જે ઓક્ટોબર ૨૦૨૩માં ૭૮.૫૭ મિલિયન ટન હતું. કેપ્ટિવ ૧૧.૮૩ એમટી હતી, જે ૩૬.૮૩ ઓક્ટોબર ૨૦૨૪-૨૫ના સમયગાળામાં ઉત્પાદન , ભારતનું કોલસાનું ઉત્પાદન ૬.૧ ટકા વધીને પ૩૭.૪૫ મિલિયન ટન (MT) ડિસ્પેચ પણ ઑક્ટોબરમાં વધીને થયું, જે ગયા નાણાકીય વર્ષના ૮૨.૮૯ એમટી થઈ હતી, જ્યારે સમાન સમયગાળામાં ૫૦૬.૫૬ <u>ઓપન ઇ-ટેન્ડર નોટિસ</u>

ટેન્ડર નં. EL/TRD/Tender/23-24/15-R-4

ભારતના રાષ્ટ્રપતિ વતી અને તેમના માટે ડિવિઝન રેવવે મેનેજર (ઇલેક્ટ્રિકલ ટીઆરડી), પશ્ચિમ રેવવે, પ્રતાપનગર, વડોદરા -390004 દ્વારા નીચે જણાવેલ કામ માટે ટેન્ડર આમંત્રિત છે. **અ.નં. 1** ટેન્ડર નં.: EL/TRD/Tender/23-24/15-R-4 **કામનું નામ:** છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે ફૂટ ઓવર બ્રિજ નું બાંધકામ અને વડોદરા ડિવિઝનને સંપૂર્ણ વીજળીયુક્ત ક્ષેત્ર માં સ્ટેશન વિકાસના સંબંધમાં OHE કાર્ય અને અન્ય આનુષંગિક કાર્ય **કામનો અંદાજીત ખર્ચ (રુ.માં):** ₹ 1,32,03,042/-બિડ સિક્યોરિટી (રુ.માં): ₹ 2,16,000/- ટેન્ડર ડોક્યુમેન્ટ્સની કિંમત અને પૂર્ણ કરવાનો **સમયગાળો:** પૂર્ણ કરવાનો સમયગાળો- 12 મહિન **ટેન્ડરનું શિડ્યુલ:** ટેન્ડર બંધ થવાની તારીખ અને સમય: તા. 04/12/2024 ના રોજ 15.00 કલાકે વેબપેજની વિગત અને નોટિસ બોર્ડનું સ્થળ જ્યાં ટેન્ડરની સંપૂર્ણ વિગત જોઈ શકાશે. અને **માહિતી માટે ઓફિસનું સરનામું:** વેબસાઇટ @ www.ireps.gov.in ડિવિઝનલ રેલવે મેનેજર (ઈલેક્ટ્રિકલ ટીઆરડી), પશ્ચિમ રેલવે, પ્રતાપનગર, વડોદરા -390 004

(EL/TRD/Tender/23-24/15-R-4 dtd. 04/11/2024) 218 મમને લાઇક કરો: 🕇 facebook.com/WesternRh

Panasonic

Panasonic Energy India Co. Ltd.

CIN: L31400GJ1972PLC002091

Regd. Office: G.I.D.C. Makarpura, P.B. No. 719, Vadodara-390010, Gujarat, India. Phone: (0265) 2642661 Email: company.secretary@in.panasonic.com Web site: www.panasonicenergyindia.in

Extract of Unaudited Financial Results for the guarter and six months ended September 30, 2024

							(₹ In Lacs
Sr. No.		Quarter Ended			Six Months Ended		Year to date ended
	Particulars	September 30, 2024 (Unaudited)	June 30, 2024 (Unaudited)	September 30, 2023 (Unaudited)	September 30, 2024 (Unaudited)	September 30, 2023 (Unaudited)	March 31, 2024 (Audited)
01	Total income from operations (net)	6,949.94	6,418.58	6,910.16	13,368.52	14,658.41	29,548.26
02	Net Profit / (Loss) from ordinary activities before tax	537.35	563.54	462.90	1,100.89	808.90	1,547.49
03	Net Profit / (Loss) from ordinary activities after tax	404.13	414.06	346.17	818.19	605.20	1,164.35
04	Total Comprehensive Income for the period (comprising profit and other comprehensive income for the period net of tax)	388.10	398.02	330.56	786.12	573.97	1,100.22
05	Paid up Equity Share Capital (Face Value of ₹10 each)	750.00	750.00	750.00	750.00	750.00	750.00
06	Earnings per share (Face Value of INR 10 each) Basic and Diluted	5.39	5.52	4.62	10.91	8.07	15.52

- 1) The above unaudited financial results have been reviewed by the Audit Committee and aproved by the Board of Directors of the Company in their respective meetings held on November 08, 2024. The Statutory Auditors of the Company have performed Limited review and have issued unmodified
- 2) The above unaudited financial results of the Company have been prepared in accordance with the Indian Accounting Standards (IND AS) prescribed under section 133 of the Companies Act, 2013 (the "Act") read with relevant rules issued thereunder, other accounting principles generally accepted in India and guidelines issued by the Securities and Exchange Board of India.
- 3) As per Indian Accounting Standard (Ind AS) 108 'Segment Reporting', the business of the Company mainly comprises sale of "Batteries" which has beer identified as a single reportable segment.
- 4) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with Stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website namely www.bseindia.com and on the Company's website www.panasonicenergyindia.in.

Place: Pithampur Date: 8th November, 2024 For Panasonic Energy India Co. Ltd. Akinori Isomura Chairman & Managing Director

The Only battery Company in India Manufacturing 100% Eco-friendly Batteries

Registered Office: 9th Floor, K P Platina, Race Course, Vadodara-390 007 CIN: L99999GJ1976PLC018945. Phone: 0265-6160100 Email: secretarial.in@inoxcva.com

HISTORICALLY FUTURISTIC

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER & HALF YEAR ENDED 30™ SEPTEMBER 2024

		Quarter Ended			Half Year Ended		Year Ended	
SI No.	Particulars	30 th September, 2024 (Unaudited)	30 th June, 2024 (Unaudited)	30 th September, 2023 (Unaudited)	30 th September, 2024 (Unaudited)	30 th September, 2023 (Unaudited)	31 st March, 2024 (Audited)	
1	Total Income from Operations	32,000	30,178	26,457	62,178	58,153	1,16,465	
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	6,860	6,793	6,044	13,653	13,617	25,778	
3	Net Profit/(Loss) for the period before tax (After exceptional and/or extraordinary Items)	6,860	6,793	6,044	13,653	13,617	25,778	
4	Net Profit/(Loss) for the period after tax (After exceptional and/or extraordinary Items)	4,949	5,264	4,625	10,213	10,334	19,600	
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	5,007	5,124	4,552	10,131	10,325	19,403	
6	Paid-up Equity Share Capital (Face Value of ₹2 per share)	1,815	1,815	1,815	1,815	1,815	1,815	
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	73,255	68,235	53,609	73,255	53,609	63,092	
8	Earning per share (Face value of ₹2 per share)*							
	- Basic	5.45	5.80	5.10	11.25	11.39	21.59	
	- Diluted	5.44	5.78	5.08	11.22	11.35	21.53	

Place: Nashik

Date: 8th November, 2024

1 The above results have been reviewed and recommended by the Audit Committee at its meeting held on November 8th, 2024 and approved by the Board of Directors at its meeting held on November 8th, 2024. The Statutory Auditors of the Company have carried out the Limited review of the above results and have issued their unmodified review report.

2 The above results are an extract of the detailed format of Quarterly Financial Results filed with the stock exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Unaudited Quarterly Standalone and Consolidated Financial Results are available of the Stock Exchnges' website (www.bseindia.com and www.nseindia.com) and on the Company's website (www.inoxcva.com).

3 Information on Standalone Financials Results:

₹ in Lakhs

		Quarter Ended			Half Year Ended		Year Ended	
SI No.	Particulars	30 th September, 2024 (Unaudited)	30 th June, 2024 (Unaudited)	30 th September, 2023 (Unaudited)	30th September, 2024 (Unaudited)	30 th September, 2023 (Unaudited)	31 st March, 2024 (Audited)	
1	Total Income from Operations	31,607	29,740	25,565	61,347	55,770	1,11,902	
2	Net Profit for the period before tax (After exceptional items)	6,853	6,850	5,794	13,703	13,016	24,563	
3	Net Profit for the period after tax (After exceptional items)	4,943	5,321	4,371	10,264	9,823	18,613	

KEY HIGHLIGHTS FOR Q2 FY 2025

- Large Export order received for Mega size LNG Trailers from
- · Large Export Orders received for LNG Storage & Distribution system from South America
- Dispatch of First Ammonia Tank of 288 M³ to Middle East
- vaporizer package
- · EPC Order (ARAMCO project) received for LIN/LOX storage and
- Received ET Energy Leadership Award 2024 in 2 Categories -EPC Company Award and Equipment Manufacture Award
- · ITER France's appreciation on Panel Repairing work by INOXCVA
- . H1FY25 Highest Ever Revenue ₹622 Cr
- H1FY25 Highest Ever EBITDA ₹153 Cr
- Q2FY25 Highest Ever Backlog ₹1178 Cr, Q2FY25 Highest Ever Order inflow ₹366 Cr

On behalf of the Board of Directors For INOX India Limited

Parag Kulkarni

Executive Director DIN-00209184

🗅 🔾 🕟 🕓 🕡 🕡 🗛 🥡



